

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
શાહીબાગ, અમદાવાદ -380003
સ્વાધ્યાય કાર્ય - 1
પાઠ્યકક્ષ કોડ : AMK-01

ઓગષ્ટ-2005

સ્વાધ્યાય કોડ : **AMK-01/AST-1/TMA/2001**
અભ્યાસ કેન્દ્રને સોધવાની છેલ્લી તા. 09/04/2006
કુલ ગુણ : 100

નોંધ : આ સ્વાધ્યાયના બે વિભાગો છે. વિભાગ-A અને વિભાગ-B તમારે બન્ને વિભાગોના ઉત્તર લખવાના છે. વિભાગ-Aના પ્રશ્નો વર્ણનાત્મક પ્રકારના છે. જ્યારે વિભાગ-B હેતુલક્ષી પ્રશ્નોનો બનેલો છે.

PART- A

1. બજાર વિભાગીકરણ એટલે શું? ગ્રાહક બજારોના વિભાગીકરણના જુદા જુદા આધારો સમજાવો. **(20)**

અથવા

- માર્કટીંગના જ્યાલો શું છે? આ જ્યાલોની ઉદ્દ્દેશ પ્રક્રિયા સમજાવો. **(3+8+9)**
2. પેદાશ વિવિધીકરણ એટલે શું? માર્કટરને ઉપલબ્ધ જુદી જુદી વિવિધીકરણની વ્યૂહરચનાઓ સમજાવો. **(3+17)**

અથવા

- પેદાશના જીવંતકાળ (PLC)નો જ્યાલ સમજાવો. અને પેદાશના જીવંતકાળના જુદા જુદા તબક્કે માર્કટીંગ મિક્સ વ્યૂહરચનાઓ કેવી રીતે બદલાતી રહે છે તેનું વર્ણન કરો. **(20)**
3. નીચે આપેલામાંથી કોઈ બે માટે યોગ્ય દાખલા આપી ભેદ સમજાવો. **(10x2)**
- (i) ઉપભોક્તા બજાર અને સંસ્થાકીય બજાર
 - (ii) માર્કટીંગ અને માર્કટ
 - (iii) સાગોત્ર (Family) બાન્ડીંગ અને વ્યક્તિગત બાન્ડીંગ
4. નીચેના વિધાનોમાંથી ગમે તે ચારનું ટૂંકમાં વિવેચન કરો. **(4x4)**
1. બજાર તપાસ દરમિયાન લક્ષ્ય બજારમાં પેદાશને પૂરેપૂરા પ્રમાણમાં મૂકાય છે.
 2. સિમેન્ટ બનાવતી કંપની આઈસ્ક્રીમ બનાવવા તરફ ચાતરે તે સંબંધિત વૈવિધ્યીકરણનો દાખલો છે.
 3. બાન્ડમાર્ક અને ટ્રેડમાર્ક તે એકનું એક જ છે.
 4. માર્કટીંગ પેદાશથી જ શરૂ થાય છે.
 5. વિશ્વાસ પ્રમાણને આધારે ઉપભોક્તાઓનું બંડીકરણ એટેમોગ્રાફીક બંડીકરણ છે.
 6. પેદાશ માર્કટીંગના જ્યાલના કેન્દ્રમાં સસ્તી પેદાશ કરવાનું છે.

PART-B

(2x10)

નોંધ : બધા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્નનો ક્રમાંક અને સાચો વિકલ્પ માત્ર લખો.

1. ઉપભોક્તાની ખરીદશક્તિ અને ખર્ચવાની તરેહોને અસર કરતાં પરિબળોની વિચારણા(પર્યાવરણ)માં થઈ શકે.
- 1. રાજકીય પર્યાવરણ
 - 2. આર્થિક પર્યાવરણ
 - 3. સાંસ્કૃતિક પર્યાવરણ
 - 4. ટેકનીકલ પર્યાવરણ
2. મેન્યુફેક્ચરીંગ પેઢીના પરચેજીંગ મેનેજર તરીકે તમે નીચેનામાંથી ક્યાં પ્રકારની વસ્તુઓ એના એજ સાખાયર પાસેથી પુનઃખરીદ કરી શકો?
- 1. ઓફિસ ઉપયોગ માટે કાર
 - 2. નવી ફેક્ટરી માટે મશીનરી
 - 2. ઓફિસ ઉપયોગ માટે કોમ્પ્યુટર
 - 4. કાચો માલ

3. નીચેનામાંથી શું માર્ક્ટીગ જ્યાલ સાથે વધુ સંબંધિત છે?
1. વધુ ઉચ્ચવેચાળ અને પ્રમોશન પ્રયાસો હાથ ધરવા
 2. ઉપભોક્તાની માંગ સંતોષવી
 3. માત્ર કવોલિટી પેદાશો જ ઉત્પન્ન કરવી 4. જે ઉત્પન્ન થયું છે તે વેચવું
4. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં બજાર બંડીકરણ પ્રમાણમાં ઓછું મહત્વનું છે.
1. પેદાશ વિકલન
 2. તશ્વાત યુક્ત માર્ક્ટીગ
 3. ઘનિષ્ઠ માર્ક્ટીગ
 4. બેદભાવયુક્ત માર્ક્ટીગ
5. પેદાશના જીવંતકાળના કયા તબક્કે હરિઝોની સંખ્યા તમારા મતે વધવા માટે છે?
1. પ્રસ્થાન
 2. વૃદ્ધિ
 3. પુખ્ત
 4. પડતી
6. ચાલુ નીચી કિમતની પેદાશ શ્રેષ્ઠીમાં ઊંચી કિમતની પ્રેસ્ટીજ પેદાશ ઉમેરવાને કહે છે.
1. ટ્રેડીગ ડાઉન
 2. અસંબંધિત વૈવિધ્યિકરણ
 3. સંબંધિત વૈવિધ્યિકરણ
 4. ટ્રેડીગ અપ
7. નીચેના વિધાનોમાંથી ખોટું કયું છે?
1. ભારતમાં બ્રાંડનું નામ રજીસ્ટર કરાવવું જરૂરી નથી
 2. નવી પેદાશ વિકસાવતી વખતે સ્ક્રીનીગ કરવાનો મુખ્ય ઉદ્દેશ વિચારોનું મૂલ્યાંકન કરી વધુમાં વધુ ફળદારી લાગે તેને અપનાવવાનો છે.
 3. પેદાશ જીવંતકાળના પ્રવેશ તબક્કે પેટી નુકશાન પણ કરે
 4. ઉપરના બધાંજ વિધાનો ખોટાં છે.
8. નીચે આપેલી વસ્તુઓમાંથી કઈ વસ્તુની ખરીદીના નિર્ણય કાળે તે પેદાશ વાપરનારની ઉમરની અસર થાય છે, એમ તમે માનો છો.
1. ધોવાનો સાખુ
 2. પુસ્તકો
 3. ટી.વી
 4. એરકન્ડીશનર
9. બ્રાંડનામ અને ટ્રેડમાર્ક વર્ચ્યેનો મુખ્ય ભેદ છે.
1. વપરાયેલો શબ્દ
 2. ઉપયોગમાં લેવાયેલા ચિત્ર
 3. વર્તુળમાં R અક્ષર હોવો
 4. રજીસ્ટ્રેશન
10. પેદાશની ખરેખર ખરીદી કરનાર વ્યક્તિ કહેવાય છે.
1. ખરીદનાર
 2. અસરો ઉભી કરનાર
 3. નિર્ણાયક
 4. પ્રસ્થાન કર્તા

પાઠ્યકક્ષ કોડ : AMK-01

ઓગષ્ટ-2005

સ્વાધ્યાય કોડ : AOM-01/AST-2/TMA/2005

અભ્યાસ કેન્દ્રને સોંપવાની છેલ્લી તા.07/05/2006

કુલ શુણ : 100

નોંધ : આ સ્વાધ્યાયના બે વિભાગો છે. વિભાગ-A અને વિભાગ-B તમારે બન્ને વિભાગોના ઉત્તર લખવાના છે. વિભાગ-Aના પ્રશ્નો વર્ણનાત્મક પ્રકારના છે. જ્યારે વિભાગ-B હેતુલક્ષી પ્રશ્નોનો બનેલો છે.

PART- A

1. કિમત નિર્ણયના હેતુ તરીકે નફાલકી અને વેચાળ પ્રમાણલક્ષી વર્ચ્યેના ભેદ આલેખો. (4+16)

અથવા

ગૃહ બજારમાં ભૌગોલિક બાબતો ઉપર પૂરેપૂરી આધારિત વિવિધ ભાવ અંગેની વ્યૂહરચનાઓ સમજાવો. તે પૈકીની કઈ લક્જરી કાર માટે અનુકૂળ ગણાય? સમજાવો.

(8+12)

2. પ્રમોશન મિક્સ એટલે શું? પ્રમોશન મિક્સના મૂળતત્વો સમજાવો. (4+16)

અથવા

જુદી જુદી પેદાશો માટે વિતરણ ચેનલો જુદી જુદી છે. શા માટે? (8+12)

3. નીચે આપેલામાંથી કોઈ બે માટે યોગ્ય દાખલા આપી ભેદ સમજાવો. (10+10)

(i) કમિશન એજન્ટ અને જથ્થાબંધ વેપારી

(ii) પુશ અને પુલ (ધક્કામાર અને આકર્ષક) પ્રકારની પ્રમોશન વ્યૂહરચનાઓ

(iii) લૂટારુંભાવ અને વિવેકયુક્ત ભાવ

4 નીચેનાં વિધાનોમાંથી ગમે તે ચાર નું ટૂકમાં વિવેચન કરો. **(4 x 5)**

- (i) ઉત્કટ હરીફાઈવાળું બજાર હોય અને સમરૂપ પેદાશ હોય ત્યારે ચાલુ (ગોઈંગ) દરની ભાવ નીતિ યથાયોગ્ય છે.
- (ii) વેચાણ સંવૃદ્ધિ વળતર મેન્યુઝેક્ચરર દ્વારા ગ્રાહકને અપાય છે.
- (iii) સરકાર ખાદ્ય વસ્તુઓના ભાવો નિશ્ચિયત કરી શકે છે. અને તેનો અમલ પણ કરાવે છે.
- (iv) લક્જરી કાર માટે ઘનિષ્ઠ વિતરણ નીતિ અનુરૂપ છે.
- (v) બધા વચોટીયાઓ—આડતિયાઓ તેમના નથી તેવા માલનું વિતરણ કરે છે.
- (vi) વેચાણ પ્રોત્સાહન સતત લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાય છે.

PART -B

(2x10)

બધાજ પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્નનો ક્રમાંક અને વિકલ્પો પૈકી સાચા ઉત્તરનો ક્રમાંક માત્ર લખો.

1. કુલ સ્થિર ખર્ચ રૂ.1,20,000 છે. એકમ દીઠ સરેરાશ બદલાતો ખર્ચ રૂ.8 છે અને એકમદીઠ વેચાણ કિમત રૂ.10 છે. તો બ્રેક ઈવન માટે કેટલા એકમો વેચવા પડે?
 1. 60,000
 2. 50,000
 3. 70,000
 4. ઉપરનામાંથી એકે નહીં
2. નીચેનામાંથી કઈ ભાવ પદ્ધતિમાં વેચનાર બધોજ વહનખર્ચ ઉપાડે છે?
 1. એફ ઓ બી (FOB) ફેક્ટરી ભાવ
 2. સમાન પહોંચતા ભાવ
 3. ઝોન ભાવ
 4. વહનખર્ચ સમાવતા ભાવ
3. એવી ભાવનીતિ કે જેમાં વેચનાર એટલા નીચા ભાવે પેદાશ વેચે છે કે જે તે પેદાશના ખર્ચ કરતાં પણ નીચા હોય
 1. ગૃહ કરારી ટેન્ડરીંગ
 2. ભેદભાવયુક્ત ભાવનીતિ
 3. લૂંટારું ભાવનીતિ
 4. પુનઃવેચાણ ભાવ જાળવણી
4. નીચે આપેલી પેદાશોમાંથી કયા માટે એક જ માલ વિતરણ વ્યૂહ અનુરૂપ છે?
 1. રિન ધોવાનો સાબુ
 2. ઝેન કાર
 3. મોર્ટિન બ્રેડ
 4. કોલગેટ ટૂથ પેસ્ટ
5. નીચે જણાવેલામાંથી કયા આડતિયાને માલનો સ્વહક્ક વેચાણ કાર્ય વખતે નથી હોતો?
 1. કમિશન એજન્ટ
 2. છૂટક વેપારી
 3. જથ્થાબંધ વેપારી
 4. ફરીને છૂટક વેચનાર
6. પેઢીમાં ભૌતિક વિતરણ વ્યવસ્થા પદ્ધતિનો સામાન્યતઃ જણાવેલ હેતુ છે.
 1. ગ્રાહકોને વધુમાં વધુ સેવાઓ પૂરી પાડવી
 2. વહેંચણી ખર્ચ આંદોલનમાં ઓછો કરવો
 3. વહેંચણી ખર્ચ નીચામાં નીચો રાખી અને ગ્રાહક સેવા મહત્તમ કરવી
 4. ખર્ચની ચિંતા કર્યા વગર ગ્રાહક સેવા મહત્તમ રાખવી.
7. નીચેનામાંથી કયું બાહ્ય માધ્યમ નથી?
 1. ભીતપત્ર
 2. નીઓન સાઈન
 3. રેઝિયો
 4. થીએટરમાં સ્લાઇડ બતાવવી
8. નીચેનામાંથી કઈ ભાવનીતિના ઉદ્દેશો અન્વયે પેદાશનો ભાવ ઉચ્ચ સ્તરે રખાય છે.
 1. બજાર હિસ્સાને મહત્તમ કરવા
 2. વેચાણ હિસ્સાને મહત્તમ કરવા
 3. મહત્તમ નફો મેળવવા
 4. હરીફનો પ્રવેશ અટકાવવા
9. નીચેનામાંથી કઈ બાબતે તમારી વિચારણા મુજબ પેઢીને નકારાત્મક અસર થવાનો સંભવ છે?
 1. જાહેર ખબર આપવી
 2. જાહેરાત આપવી
 3. વ્યક્તિગત ધોરણે વેચાણ કરવું
 4. વેચાણ વૃદ્ધિ સુંબેશ
10. જાહેર ખબર આપવાના સંદર્ભમાં આપેલા સમયગાળામાં સરેરાશ વ્યક્તિને કેટલી વખત સંદેશો પહોંચાડાય છે. તેને કહેવાય છે.....
 1. મિડીયા શેડ્યુલીંગ
 2. રીચ-ફેલાવ પહોંચ
 3. આવર્તન પ્રમાણ
 4. ઉપરનામાંથી એકે નહીં

-X-X-X-X-X-X-

